

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૧૨/૨૦૧૬ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩૯૪/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૮ કેસ કરી, ૩૭ વ્યક્તિઓને ઝડપી, ૧૧૫ લીટર દેશી દારૂ, ૧૨ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧૪૪ બિયર બોટલ, ૭૨ બિયર ટીન અને ૦૧ ટેમ્પો કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૦૧ કેસ કરી ૧૧ વ્યક્તિઓને ઝડપી, રોકડ રૂપિયા ૪૭,૨૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩૯૫/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૩૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૮ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ :-

સમાચાર યાદી નં.૨૩૯૬/૧૬

દાણીલીમડા : લતાબેન વા/ઓફ જગદીશભાઈ ભાટીયો (ઉ.વ.૪૪)(રહે,કર્ણાવતી એપાર્ટમેન્ટ બંગલા એરીયા કુબેરનગર)એ તા.૨૭/૧૨/૧૬ નારોજ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સપ્ટેમ્બર/૨૦૧૪ થી આજદિન સુધીનાં સમયગાળા દરમ્યાન આરોપી જય પેકેજીંગનાં ભાગીદાર અમીનભાઈ અને શરીફભાઈ તથા હનીફભાઈ તથા સોનલ ગૃહઉઘોગના ભાગીદાર સોયેબભાઈ તથા મલીકભાઈ નાઓ તથા એજન્ટ કુશલભાઈ તિવારી (જે તમામનાં પુરા નામ-સરનામાની ખબર નથી) ભેગામળી લતાબેનનાં માસા ચંદ્રશેખર નાઓ પાસેથી રૂપિયા ૧૪,૪૮,૩૦૩/- નો માલ તથા સોનલ ગૃહઉઘોગના ભાગીદાર સોયેબભાઈ તથા મલીકભાઈ નાઓએ રૂપિયા ૧૬,૧૧,૪૬૭/- નો માલ મંગાવેલ જે માલ પેટે નાં નાણાં છ માસમાં ચુકતે કરી દેવાનો ભરોસો આપી, માલ પેટે આપેલ કોરા ચેક બેંકમાં નહીં ભરાવાનું જણાવી, વિશ્વાસમાં લઈ, આજદિન સુધી માલનું પેમેન્ટ નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એચ.એન.પટેલ ચલાવે છે.

કાઇમબ્રાન્ય : માયાબહેન તે રાજેન્દ્રકુમાર બંસીલાલ દુબેની વિધવા પત્ની (ઉ.વ.૪૧)(રહે.રતનપાર્ક સોસાયટી ગાયત્રી સ્કુલ પાસે, ખોડીયાર નગર નિકોલ રોડ બાપુનગર) એ તા.૨૭/૧૨/૧૬ નારોજ કાઇમબ્રાન્ય ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે જુન/૨૦૧૫ થી તા.૨૮/૯/૧૫ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) દિપક ચતુવેદી ફોન ૯૫૯૯૨૯૯૧૬૭ ૮૫૧૦૯૮૬૮૨૪ ૯૫૯૯૦૫૨૩૩૪ (૨)દેવાંગ સોલંકી મોન ૮૧૪૧૧૦૨૧૦૮ તથા ૮૪૦૧૬૩૨૪૨૪ (૩) મનીષ ટંડન ફોન ૭૮૩૮૦૬૯૨૩૯ (૪) ચૌહાણ સાહેબના ફોન ૯૯૭૧૪૭૭૬૧૧ (૫) આત્મારામ પાંડે ફોન ૯૯૭૧૪૮૬૪૨૧ ૦૮૫૭૦૪૦૭૧૦૭ ૮૪૫૯૪૦૭૧૦૭ (૬) રામદિપ ચૌધરી ફોન ૯૯૭૧૪૮૬૪૨૧ ૦૮૫૭૦૪૦૭૧૦૭ ૮૪૫૯૪૦૭૧૦૭ (૭)અરુણા દિવાકર સેન્ટ્રલ બેંક જોધપુર રાજસ્થાન બ્રાન્યના ખાતા નંબર ૩૪૬૧૦૧૦૧૨૭ ના ધારક અને (૮) અનીલ ભડારી ફોન ૯૧૩૬૫૫૯૫૯૬ ભેગામળી માયાબહેનની મેક્ષ કંપનીની પોલીસીમાં ભરેલ નાંણા તથા બોનસ અપાવવાની લાલચ આપી. માયાબહેનને એક સાઇડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીની પોલીસી આપી, તે કંપની મારફતે માયાબહેનની મેક્ષ કંપનીનાં નાણાં પાછા અપાવવાની લાલચ આપી, માયાબહેન પાસેથી રોકડ, ચેક તથા એન.ઇ.એફ.ટી મારફતે કુલ રૂપિયા ૪,૨૮,૬૦૧/- મેળવી લઇ માયાબહેન સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી ડી.એસ.ગોહીલ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૨૩૯૭/૧૬

પાલડી : ચન્દ્રેશ લલીતભાઇ શાહ (રહે,આર્યવ્રત સ્કાયસ બિકાનેરવાળાની પાછળ, એસ.એમ.રોડ નહેરુનગર) એ પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૧૨/૧૬ સાંજનાં ૭/૦૦ થી ૮/૧૫ વાગ્યા દરમ્યાન પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલ સેન્ટ્રલ બેંક ની સામે રોડ પર પાર્ક કરેલ પોતાની સ્કોડા રેપીટ કારનાં ડ્રાઇવર સાઇડનાં પાછળના દરવાજાનો કાચ તોડી, અજાણી વ્યક્તિ કારમાંથી લેપટોપ કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી દિનેશભાઇ વાલજીભાઇ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૩૯૮/૧૬

કૃષ્ણનગર: ચિત્રાબેન ડો/ઓ દિનેશભાઇ સોલંકી (ઉ.વ.૨૨)(રહે,કુબેરદાસની ચાલી, ખોડીયાર માતાના મંદિર પાસે સૈજપુર બોધા) એ તા.૨૭/૧૨/૧૬ ના કલાક ૦૦/૦૦ થી ૪/૦૦ વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખા સાથે દુપદ્મથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.વી.ખરાડી ચલાવે છે.

મેઘાણીનગર : શારદાબેન ધનપાસભાઇ વણઝારા (રહે,ચીમનલાલ મહાસુખલાલની ચાલી ચમનપુરા મેઘાણીનગર) એ અગમ્ય કારણસર તા.૨૧/૧૨/૧૬ ના રોજ પોતાના ઘરમાં પડેલી “ જુ ” મારવાની દવા પી જતાં, શરીરે અસર થતાં સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૭/૧૧/૧૬ ના કલાક ૬/૩૦ વાગે શારદાબહેનનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી વાચ.પી.પટેલ ચલાવે છે.

રિવરફ્રન્ટ (વેસ્ટ) : દર્શિની D/O સુરેશભાઈ ગોહેલ (ઉ.વ.૧૮)(રહે.દલાલ બિલ્ડીંગ હિન્દી શાળા પાસે, જુના વાડજ) એ પોતાની બીમારીથી કંટાળી જઈ તા.૨૭/૧૨/૧૬ ના કલાક ૧૧/૪૫ વાગ્યા પહેલાં કોઈપણ સમયે બાટા શો રૂમની પાછળ સાબરમતી નદીમાં ડુબી જઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રિવરફ્રન્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.જી.ડાભી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.